



### COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં માર્ચ 31 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 30, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપતી હોવાની ખાતરી કરાવવા, બસ સર્વિસમાં નીચે જણાવ્યા પ્રમાણે ફેરફાર, માર્ચ 31 થી અમલમાં આવશે:

આવતી કાલથી અને આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી સવારે (6 AM થી 9 AM) અને બપોરથી સાંજ સુધી (3 PM થી 7 PM) વ્યસ્ત ટ્રાફિક સમય દરમિયાન નીચે જણાવેલા રૂટ્સમાં સર્વિસ હવે પછી મળશે નહીં. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સવારે લગભગ 9 થી બપોરે 3 વાગ્યા સુધી, અને સાંજે 7 વાગ્યા પછી, રાબેતા મુજબ સર્વિસ આપવાનું ચાલુ રાખશે.

- 12 ગ્રેનોબલ
- 13 એવોનડેલ
- 16 સાઉથગેટ
- 17 હાઉડન
- 19 ફર્નફોરેસ્ટ
- 32 ફાધર ટોબિન
- 33 પીટર રોબર્ટસન
- 56 કિંગનોલ

અમે ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના આચરણોને ટેકો આપવા બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠક જેટલી સીમિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કેટલાક બહુ વ્યસ્ત રૂટ્સ પર વધારાના સંસાધનોની ફાળવણી ફરીથી કરવાના હેતુસર આ ફેરફારો કરવામાં આવશે.

વધારે સારી સફાઈ અને ચેપનાશક સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને ચેપરહિત કરવામાં આવશે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ [www.brampton.ca/covid19](http://www.brampton.ca/covid19) અને [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905-874-2999 નંબર પર પૂછી શકાય છે.



# BRAMPTON

## Service and Information Update

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया ओन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूहान्मक संवाट

सीटी ओफ़ ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)